

ચાર્જિઝનું પરિશિષ્ટ – ગોલ્ડ લોન (20 મી માર્ચ 2025 થી અસરમાં આવશે)		
વિગતો	શુલ્ક (રૂ.)	
લોન પ્રોસેસિંગ ફી	લોનની રકમના વધુમાં વધુ 2%	
દંડાત્મક શુલ્ક	બુલેટ	EMI/ ફક્ત વ્યાજ / OD સ્કીમ
	કુલ ઓવરડયુ રકમ પર વાર્ષિક 36%	પેનલ ચાર્જિસ લેણું મોડુ બનતી રકમ પર, ડયુ ડેટથી ખરેખર પેમેન્ટની તારીખ સુધીની રકમ વત્તા લાગુ પડતાં કર કે અન્ય વૈધાનિક લેવી (કર), જો હોય તો, તેની પર વાર્ષિક 36%થી ઉપર નહીં હોય
EMI બાઉન્સ ચાર્જીસ	રૂ. 500/- (દરેક બાઉન્સ ઇન્સ્ટ્રુમેન્ટ માટે)	
નોટિસ શુલ્ક	રૂ. 50/- નોટિસ દીઠ	
કસ્ટોડિયન ચાર્જીસ	36% પ્રતિ વર્ષ (મંજૂર લોનની રકમ)	
સ્ટેમ્પ ડયુટી શુલ્ક	દરેક લોન ખાતા દીઠ રૂ. 200/- (રાજ્ય કક્ષાએ સરકારી નિયમન/ધારાકીય ચાર્જિઝની જરૂરિયાતને આધીન)	
ફોરક્લોઝર શુલ્ક	બાકી રહેતા મુદ્દલના 2%	
ઓવર ડ્રો કરેલ રકમ પર ચાર્જિઝ	ડ્રોઇંગ સત્તાથી વધારે ઓવર ડ્રો કરેલી રકમ પર બિન-અનુપાલનતાના સમય માટે વાર્ષિક 24%	
પ્રિ-પાઈ પેમેન્ટ ચાર્જિઝ	પ્રિ-પેઇડ રકમના વધુમાં વધુ 2%	
કમિટમેન્ટ ફી	બિન-વપરાયેલ રકમ પર (મંજૂર કરેલી મર્યાદા-વપરાયેલી રકમના 70%) 1% જો માસિક બિન-વપરાયેલી રકમ મંજૂર કરેલ મર્યાદાથી 60% કરતાં ઓછી હોય તો. આ ત્રૈમાસિક ધોરણે ચાર્જ થશે.	
લોન રી-શેડ્યુલ ચાર્જિઝ (ગ્રાહકે કરેલા બધા વ્યવહારો)	દરેક લોન રી-શેડ્યુલ પર રૂ. 500/=	
હરાજીની જાહેરાત	ખરેખર ચૂકવેલ રકમ, સમાચારપત્ર પ્રકાશકો પર આધારિત	
હરાજી ચાર્જિઝ	દરેક લોન ખાતા દીઠ રૂ. 150/-	
એપ્રાઇઝર ચાર્જિઝ	દરેક લોન ખાતા દીઠ રૂ. 799/- થી વધુ નહી	
* ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) લાગુ પડતા દરો મુજબ, તમામ શુલ્ક અને ફી પર વધારાનો ચાર્જ લેવામાં આવશે		
** બધા ચાર્જ સ્કીમ અને મુદત તથા વૈધાનિક જરૂરિયાતો પર આધારિત ફેરફારને આધીન છે		